પ્રગટ કર્તા,

શ્રી ઓલપાડ શિવરાત્રી મંડળ તરફથી

વસંતરાય માણેકરાવ દેશાઈ.

ઓલપાડ.

સુરત ચૌટાના પુલ ઉપર ટાંકી પાસે "[illegible]" ના.

પ્રેસમાં નારાયણરાવ એસ. નીકમે છાપી.

સંવત ૧૯૮૨] [સને ૧૯૨૬.

ॐ नमः शिवाय:

શ્રી શંકર સ્તોત્ર
અને આરતી.



ॐ

नमः शिवाय.

મંગલમ.

શાંતાકારં શિખિર શયનં, નિલકંઠં સુરેશમ્.
વિશ્વાધાર સ્ફટિક સદ્દશં, શુભ્રવર્ણ શુભાંગમ્;
ગૌરીકાંતં ત્રિતય નયનં. યોગિભિર્ધ્યાનગમ્યમ્.
વંદે શંભુ ભવભય હરં. સર્વલોકૈક નાથમ્. ૧.

આરતી.

જય ગિરિજા જાને. જય ગીરિજા જાને.
ત્વત્ પદ મધિકં પુરહર (૨) મનસાર્પિત જાને.
ૐ હર હર હર મહાદેવ.

જલનિધિ સ્થલનિધિ શંભો, પત્રિકૃત શૌરે (૨)
દર્વી કરવર ભૂષણ (૨) સંબર કદનારે;
અંબર કેશ મહેશ્વર, ધૃતગંગા વારે (૨)
ગૌરીવ ભવભય નિર્ભય (૨) ભય પારાવારે. ૐ હર.

અર્થિની વિભુતામસ્તક, માલિની મંગલતા (૨)
મન્મથ વૈરિણી વનિતા (૨) વૈરાગિણી મમતા;
વીશ ભુજ મૃત્યું જયતા, ભવ સુંદર ભવિતા (૨)
ત્વયિ જગદીશે વિલસતિ (૨) ધન્યા શિવ મુદિતા. ૐહર.

અદ્દભુત મીશ્વર રૂદ્રે, ત્વયિ કરૂણા બંધો (૨)
વિસમિતિ દષ્ટો સમતા (૨) દષ્ટ્વા ત્વયિ સાધો.
સ્વામિની વિકૃતિ વિભુતા, વિસ્મતિ સુર બંધો (૨)
દુર્ગમ લીલા વિભુતા (૨) ત્વયિ કરૂણા સિંધો. ॐहर.

નિજપદ રતજન પંજર, ભવજલ નિધિપેતો (૨)
માયામય મય ભવભય (૨) હિતજન જીવાતો:
વીધી હર ગુરવર કિંનર, મુનિવર સુખ હે તો (૨)
દીન દયાલય પાલટય (૨) નૃપનાયક કેતો ॐहर.

તત્ ધન મૃગીરાનૃત્યુત, ધ્વનિ ગર્જીત ગગનાં (૨)
સારી ગમ પધની ના થૈ (૨) ધીમકતી રત્નીવદનાં.
સાથં સેવન સમયઃ સ્તુવંતુ વિધિવદના (૨)
ત્વાં પ્રતિ વિરમતી ધિષણા (૨) વિરહતુ ભૂમિવદના ॐहर.

રવિ, શશિ, પાવક લોચન, મૃગાંક મણી મૌલે, (૨)
ફણી માણી મંગલ દિપક (૨) નિરાંજીત મૌલે,
સુરતરૂ સુરભિ, ભગવતી શ્રી શૈલે (૨)
વિસ્હતુહ્રદય ભગવતિ (૨) સ્તુતિ દુર્ગમ લીલે ॐहर.

ત્વાં બંધ્વાં જલિ નત્વા. પ્રમથાધિપ નાથે (૨)
જન્મનિ જન્મનિ તિષ્ઠતુ (૨) ભક્તિ ત્વયિનાથે,
ત્વદ્દચિન્તે, ત્વદ્દવિતે, ત્વદ્ મૃહિતેનાથે, (૨)
કુરૂ કરૂણાં કરૂણામય (૨) વ્યંકટી રઘુનાથે ॐहर.

ઇતિ.

શિવ તાંડવ સ્તોત્ર પ્રારંભ.

મદીય માનસે મૃદે, શિવં શિવં પદં વિભુમ્,
દધામિ યામી યાશ્રતો, નયામિ ચાન્યથા વૃથા. ૧

શદે દશિર્મતિર્મયા, સુસુધ્ધિદા સુનિશ્ચિતા,
વિલોકય શાસ્ત્ર માદરા, પ્રતિક્ષણં મુહુર્મુહુ ૨

નમે મનઃ કલેવરે, કલકિતે કલા નિધૌ,
કલા નિધૌ સુનિર્મલે, મનઃ કલા શિવે મલા. ૩

રિપૌ જલધરસ્યનો, મનઃ સુગાંગ મસ્યવે,
સરોજ રાજ રાજીતે, વિરાજીતે કપર્દિકે ૪

ભુજંગરાજ રાજીતે, વિભૂતિ ભૂતિ ભુષીતે;
પ્રમોદ ચંદ્ર શેખરે, સુચિત્ત મસ્તુ મે શિવે ૫

લશદ્દુકુલ કાંચને, સુલોચને સુભુતિ દે,
અકાંડ તાંડવ પ્રિયે, પ્રિયેનમોસ્તુ નિર્મલે. ૬

નમે મતિર્જને વરે, વનીયકે વને વનૌ,
સુવર્ણ કે સુવર્ણ કે, સુવર્ણકે મનઃ શિવે. ૭

સુરેન્દ્ર વર્ગ સેવિતે, મહોક્ષ વાહન પ્રિયે,
લસત્કપાલ માલિકે, મનો સ્તુનઃશિવે શિવે. ૮

વિશાલ શાલ સંનિભે, વિશાલ લોચને શિવે,
વિશાલ વક્ષસ પ્રિયે, મનો વિશાલ બુદ્ધિદે. ૯

ઈયમ્ નગ સ્વરૂપિણી, શિવાંઘ્રિ પંકજે સતિ,
ઇમં નરો વહન્મુખે, મહેસ્તુ સંપદં શિવમ્ ૧૦

શ્રી શંકર સ્તોત્ર પ્રારંભ.

જય જય શંભો ગિરિજા બંધા, જય જય શંકર ભૂતપતે;
ગિરિશ મહાપદ જલધિ રમ્મા, ન્યુદ્ધર ધીર કૃપા જલધે, ૧

નામેવોત્તમ હસ્તં વિમલ, મંગલ દાયક મંગલદ; ગિરિશ૦
દિવસુર નાયક મંગલ વિગ્રહ, કુરૂમમ મંગલ માસવિભો; ગિરિશ૦
શરણંયામ શ્ચરણં દ્દ, તવપદ કમલા મનુવેલં; ગિરિશ૦
તવપદ કમલા દમલા દૈન્યં, મર્ચિત મપિ નહિ ચેતસી શંભો; ગિરિશ૦
શિવમય મસિવંન ભૂત્ત્વા મરલ, ત્વયિશશિ શશિવે શિવમૂર્તે; ગિરિશ૦
ભગવન્ ભવતા ભવના પહતા, નુરિત દુરિતં કિંનુ કૃત; ગિરિશ૦
સકૃદપિ તવ હરનામ સ્મરણ, કૃતમઘ્ન કુલ હરતિ સુભદ; ગિરિશ૦
સ્મૃતમપિ તવહર ચરણ દ્દ, હરતિ વિસાદં કિંસુ દૃષ્ટ; ગિરિશ૦
ભવભય દીનાનસ્માનનિસ, કુરૂગત દુઃખાનતિ દુઃખાત; ગિરિશ૦
હરપ્રદસ્મા કૃતમપરાધં, વિવિધિ કૃપયા હરસિતદા; ગિરિશ૦
સુતમપરાધિન મપિકૃતશિક્ષાં, જનક પાલયતીસ તથા; ગિરિશ૦
નસુતા વયમપિ તવ કિં શંભો, જનક સ્વભયા નસ્માકં; ગિરિશ૦
જગતામેકો જનક સ્વમતો, વયમપિ જગતો નહિ ભિન્ના; ગિરિશ૦
ભવતા સૃષ્ટા સકલા લોકા, વયમપિતદવદ્ધર સૃષ્ટા; ગિરિશ૦

શિવસ્ય નંદતે નવં. સુનિર્મિતાં સુસસ્તવં.
પઠેન્નરો નર.ધિયો ભવે ભવં મહાશિવં ૧૧

ઇતિ સમાપ્ત.

ભવતા સૃષ્ટં જગદિવ સૃષ્ટા, તસ્માનપિ ભવપાલય નિત્યં; ગિરિશ૦
દેવ ગજાસુર પરિરત વિભવા, નભયમભગં તવ મદન; ગિરિશ૦
નિરૂપતિ કરૂણા પારાવાર, રત્વમતે હરહર મુઃખ દુઃખં; ગિરિશ૦
શરણં ભવભય શરણ ભવભય, શરણ ભવભય કરૂણાબ્ધે; ગિરિશ૦
ભવભય હન્યં નવ યંયામ; સકૃતપિ સ્મરણં મરણેવા; ગિરિશ૦
નહિ જાનિમા ભવભય હન્ય, શંકર ધીર પાતાલં; ગિરિશ૦

શિવહર શંકર ગવરિશ, વંદે ગંગા ધરણીશ,
રૂદ્ર પશુ પતિ મિશાન, શિવકારે નાશી કરૂણાશં.

ઇતિ.

